

શિક્ષક/વિદ્યાસહાયક માટે ઓન-લાઇન જનરલ બદલી અંગેની સુચના

- શિક્ષક/વિદ્યાસહાયક તા. 11/09/2017 ના 12.00 કલાકેથી તા. 13/09/2017 ના 23:59 કલાક સુધી www.dpegujarat.org વેબસાઇટ પર ઓન-લાઇન બદલી માટે અરજી ફોર્મ ભરી શકશે.
- શિક્ષક/વિદ્યાસહાયકે ઓન-લાઇન કન્ફર્મ કરેલ બદલી માટેના અરજી ફોર્મ જરૂરી આધાર - પુરાવા સાથે તા. 11/09/2017 ના 11.00 કલાકેથી તા. 14/09/2017 ના 14:00 કલાક સુધી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીશ્રીને આપવાના રહેશે.

શિક્ષક/વિદ્યાસહાયકે અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સુચના:

- શિક્ષક/વિદ્યાસહાયક જે જિલ્લામાં નોકરી કરતાં હોય તે જ જિલ્લો પસંદ કરવો.
- અરજી ફોર્મ ખુલતા તેમાં જરૂરી માહિતી ભરી અરજી ફોર્મ સેવ કરવું.
- અરજી સેવ કર્યા બાદ જે અરજી રજીસ્ટ્રેશન નંબર મળે તે અને જન્મતારીખ નોંધી રાખવી.
- ત્યાર બાદ ફોટો અને સહી અપલોડ કરવા રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ ટાઇપ કરી ફોટો (૫૦KB) અને સહી (૨૦KB સુધી) અપલોડ કરવી.
- શાળાઓની પસંદગી કરવા રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ ટાઇપ કરી શાળાઓની પસંદગી યોગ્ય રીતે કરવી.
- રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ ટાઇપ કરી અરજી ફોર્મ કન્ફર્મ કરવું.
- અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજી ફોર્મની પ્રિન્ટ બે કોપીમાં મેળવી લેવી.
- અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજીમાં કોઇ સુધારા કરી શકાશે નહીં.
- અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ સુધારો ઇચ્છતાં ઉમેદવારે ફરીથી નવું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- કન્ફર્મ થયેલ અરજી ફોર્મ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીની કચેરીમાં તા. 14/09/2017 ના 14:00 કલાક સુધીમાં જરૂરી આધાર - પુરાવા સાથે જમા કરાવી તાલુકા પ્રથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીશ્રી પાસેથી પહોંચ મેળવી લેવાની રહેશે.
- કન્ફર્મ થયેલ અરજી છેલ્લા દિવસ સુધી રાહ જોયા વિના કન્ફર્મ થયાના દિવસે કે મોડામાં મોડા બીજા દિવસે જમા કરાવવાની રહેશે. અન્યથા છેલ્લા દિવસે એક સાથે ઘસારો થવાના કારણે નિયત સમયમર્યાદા બહાર અરજી સ્વીકારવામાં આવશે નહીં તો તેની જવાબદારી સંબંધિત શિક્ષકની રહેશે.
- ઓનલાઇન બદલીના પ્રથમ રાઉન્ડમાં જે શિક્ષક/વિદ્યાસહાયકનો બદલી હુકમ થયેલ ન હોય તેવા શિક્ષક/વિદ્યાસહાયક બીજા રાઉન્ડમાં અરજી કરવા ઇચ્છે તો તેઓ ઓનલાઇન પસંદગી બદલી શકશે.
- ઓનલાઇન બદલીના પ્રથમ રાઉન્ડમાં જે શિક્ષક/વિદ્યાસહાયકનો બદલી હુકમ થયેલ હોય તેવા શિક્ષક/વિદ્યાસહાયક બીજા રાઉન્ડમાં અરજી કરી શકશે નહીં.
- શિક્ષકોએ ઓનલાઇન શાળા પસંદગી વખતે ડાયસ કોડ અને શાળાનું નામ પસંદ કરવા માટે પુરતી કાળજી લેવાની રહેશે. પસંદગી મુજબ ઓનલાઇન થયેલ બદલી હુકમ કોઇપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં.

શિક્ષક/વિદ્યાસહાયકે અરજી ફોર્મ ભરતી વખતે સાથે રાખવાની વિગત:

- હાલ જે શાળામાં નોકરી કરતાં હોય તે શાળાનો ડાયસ કોડ તથા પગાર કેંદ્ર શાળાનો ડાયસ કોડ (વર્ષ : 2015-16 ના DISE School Code પ્રમાણે)
- ખાતામાં દાખલ તારીખ
- હાલની શાળાની દાખલ તારીખ / વધના આદેશની તારીખ
- જન્મ તારીખ
- સ્કેન કરેલ ફોટો (૫૦ kb સુધી) અને સહી (૨૦ kb સુધી) સોફ્ટ કોપીમાં
- વધની બદલીની સિનીયોરીટી માટેના આધાર- પુરાવા
- મૂળ શાળા પરત અંગેના આધાર- પુરાવા (શાળાના ડાયસ કોડ વર્ષ : 2015-16 ના DISE School Code પ્રમાણે)
- માંગણીની બદલીમાં વિધવા, અપંગ, દંપતિ અને વાલ્મિકી અંગેના આધાર-પુરાવાઓ.
- હાલની શાળાની નોકરી અંગે મુખ્યશિક્ષકનો દાખલો
- PAN કાર્ડ (મરજીયાત)

નોંધ: ઉમેદવારે ફોર્મ ભરી વખતે આપેલ ખાલી જગ્યાવાળી શાળા પસંદ કરતી વખતે નીચેની બાબત ખાસ ધ્યાને લઇ શાળા પસંદ કરવી:

1. લાલ (RED) કલર માં દર્શાવેલ શાળાઓની ખાલીજગ્યા જિલ્લા ફાળવણીથી જનાર, હાલ છુટા નહિ થયેલા શિક્ષકની ખાલી જગ્યા છે
2. વાદળી (BLUE) કલર માં દર્શાવેલ શાળાઓની ખાલીજગ્યા જિલ્લા વિભાજનથી જનાર, હાલ છુટા નહિ થયેલા શિક્ષકની ખાલી જગ્યા છે
3. લીલા (GREEN) કલર માં દર્શાવેલ શાળાઓની ખાલીજગ્યા આંતરિક-બદલીથી જનાર, હાલ છુટા નહિ થયેલા શિક્ષકની ખાલી જગ્યા છે
4. તે સિવાય ની શાળાઓમાં હાલ સ્પષ્ટ ખાલી જગ્યા છે.